

Enrollment No: \_\_\_\_\_

Exam Seat No: \_\_\_\_\_

# C.U.SHAH UNIVERSITY

## Summer Examination-2017

**Subject Name : Basic Electronics Engineering**

**Subject Code : 2TE02BEE1**

**Branch : Diploma(Electrical)**

**Semester : 2**

**Date : 12/05/2017**

**Time : 02:00 To 05:00**

**Marks :70**

Instructions:

- (1) Use of Programmable calculator & any other electronic instrument is prohibited.
- (2) Instructions written on main answer book are strictly to be obeyed.
- (3) Draw neat diagrams & figures (if necessary) at right places.
- (4) Assume suitable & perfect data if needed.

<b>Q-1</b>	Attempt the following questions	(14)
a.	Write the unit of capacitor	(1)
	A. Ohm B. Faraday C. Ampere D. Watt	
b.	Find the resistance of yellow violet brown	(1)
	A. $370\Omega$ B. $470 \Omega$ C. $110 \Omega$ D. $440 \Omega$	
c.	SPST Switch means	(1)
	A. Single pole single ton B. Single pole single throw C. Single pole side throw D. None of above	
d.	Liquid switch is one type of .....switch	(1)
	A. Proximity B. Tactile C. Sensing D. Limit	
e.	RJ 45 connector has .....wire	(1)
	A. 12 B. 8 C. 4 D. 6	
f.	Optical fibers cable used in .....	(1)
	A. Tele communication B. TV C. Digital Transmission D. All of Above	
g.	Which kind of a device is a diode?	(1)
	A. Bilateral B. Linear C. Nonlinear D. Unipolar	



- h. In an n-type semiconductor electrons are \_\_\_\_\_ and holes are \_\_\_\_\_. (1)  
 A. Majority, Majority  
 B. Minority, Minority  
 C. Minority, Majority  
 D. Majority, Minority
- i. What is the maximum efficiency of half wave rectifier? (1)  
 A. 80%  
 B. 90%  
 C. 40%  
 D. 50%
- j. Full form of LDR is (1)  
 A. Light dependent resistor  
 B. Light doping ruff  
 C. Light design resistor  
 D. None of above
- k. A transistor has how many doped regions? (1)  
 A. 1  
 B. 2  
 C. 3  
 D. 4
- l. Which one of below equation is correct one for npn transistor? (1)  
 A.  $\beta = \frac{I_C}{I_B}$   
 B.  $\beta = \frac{I_B}{I_C}$   
 C.  $\beta = \frac{I_E}{I_B}$   
 D.  $\beta = \frac{I_E}{I_C}$
- m. Choose the correct formula of RMS current for full wave center tap rectifier.. (1)  
 A.  $\frac{I_m}{\pi}$   
 B.  $\frac{I_m}{2}$   
 C.  $\frac{I_m}{\sqrt{2}}$   
 D.  $\frac{2I_m}{\pi}$
- n. Capacitance C= (1)  
 A.  $C=Q/V$   
 B.  $C=V/Q$   
 C.  $C=I^*Q$   
 D.  $C=I/Q$

**Attempt any four questions from Q-2 to Q-8**

- Q-2      Attempt all questions (14)**
- (A) Draw and Explain energy band diagrams of insulator, semiconductor and conductor (7)  
 (B) Explain characteristics of P-N junction diode. (7)
- Q-3      Attempt all questions (14)**
- (A) Explain types of resistor according to construction. (7)  
 (B) Explain about different types of capacitors. (7)



Q-4	<b>Attempt all questions</b>	(14)
	(A) List the different types of switches with its symbols.	(7)
	(B) Explain working principles of electromagnetic relay.	(7)
Q-5	<b>Attempt all questions</b>	(14)
	(A) Explain half wave rectifier with circuit diagram & waveform.	(7)
	(B) Describe $\pi$ type filter.	(7)
Q-6	<b>Attempt all questions</b>	(14)
	(A) Derive the relation between current gain parameter $\alpha$ & $\beta$ .	(7)
	(B) Explain about construction of transistor.	(7)
Q-7	<b>Attempt all questions</b>	(14)
	(A) Describe different types of cables	(7)
	(B) List different types of fuse and Explain any one	(7)
Q-8	<b>Attempt all questions</b>	(14)
	(A) Explain about varactor diode	(7)
	(B) Write down color coding method for resistor.	(7)

Q-1	Attempt the following questions	(14)
a.	કેપેસીટર નો એકમ લાખો	(1)
	A. ઓહસ B. ફરડ C. એમ્પીયર D. વોટ	
b.	પીળા જામણી બ્રાન્ડન માટે અવરોધ ની કિમત શોધો.	(1)
	A. $370\Omega$ B. $470 \Omega$ C. $110 \Omega$ D. $440 \Omega$	
c.	લીકવીડ સ્વીચ એ એક પ્રકાર ની ..... સ્વીચ છે	(1)
	A. પ્રોફેશિનલ B. ટેકાઇલ C. સેસીંગ D. લીમીટ	
d.	RJ 45 કનેક્ટર ની પાસે..... વાયર હોય છે	(1)
	A.12 B.8 C.4	



- D.6
- e. ઓફીસલ ફાયબર કેબલ .....મા વપરાય છે (1)  
 A. ટેલી કોમ્યુનિકેશન  
 B. ટીવી  
 C. કીજીટલ ટ્રાંસ્મિસન  
 D. ઉપર ના બધા
- f. ડાયોડ એ કયા પ્રકાર નું સાધન છે? (1)  
 A. બાયલેટરલ  
 B. લીનીયર  
 C. નોન લીનીયર  
 D. યુનીપોલર
- g. N પ્રકાર ના સેમીકંડક્ટર મા ઇલેક્ટ્રોન .....છે અને હોલ.....છે (1)  
 A. મેજોરીટી, મેજોરીટી  
 B. માઇનોરીટી, માઇનોરીટી  
 C. માઇનોરીટી, મેજોરીટી  
 D. મેજોરીટી, માઇનોરીટી
- h. ફાફ વેવ રેક્ટીફાયર ની મહત્વમ કાર્યદક્ષતા કેટલી છે? (1)  
 A. 80%  
 B. 90%  
 C. 40%  
 D. 50%
- i. LDR નું પુર્ણ નામ જણાવો (1)  
 A. લાઇટ ડિપેન્ડ રેગીસ્ટર  
 B. લાઇટ ડોપીંગ રફ  
 C. લાઇટ ડિઝાઇન રેગીસ્ટર  
 D. ઉપર માથી કોઈ નહીં
- j. ટ્રાંઝીસ્ટર મા કેટલા રીજિયન ટોપ કરેલા હોય છે? (1)  
 E. 1  
 F. 2  
 G. 3  
 H. 4
- k. NPN ટ્રાંઝીસ્ટર માટે કયું સુત્ર સાચું છે? (1)  
 A.  $\beta = \frac{I_C}{I_B}$   
 B.  $\beta = \frac{I_B}{I_C}$   
 C.  $\beta = \frac{I_E}{I_B}$   
 D.  $\beta = \frac{I_E}{I_C}$
- l. કુલ વેવ સેંટર ટેપ રેક્ટીફાયર માટે આર.એમ.એસ પ્રવાહ નું સાચું સુત્ર નક્કી કરો .. (1)



- E.  $\frac{I_m}{\pi}$   
F.  $\frac{I_m}{2}$   
G.  $\frac{I_m}{\sqrt{2}}$   
H.  $\frac{2I_m}{\pi}$

m. કેપેસીટંસ C= (1)

- E.  $C=Q/V$   
F.  $C=V/Q$   
G.  $C=I*Q$   
H.  $C=I/Q$

Attempt any four questions from Q-2 to Q-8

Q-2	Attempt all questions	(14)
(A)	અવાહક, અર્ધ વાહક અને વાહક નો એનજી બેંડ ડાયાગ્રામ દીરો અને સમજાવો (7)	(7)
(B)	P-N જંક્શન ડાયોડ ની લાક્ષણિકતા સમજાવો (7)	(7)
Q-3	Attempt all questions	(14)
(A)	અવરોધ ના પ્રકાર તેના બંધારન ને આધારે સમજાવો (7)	(7)
(B)	જુદા જુદા પ્રકાર ના કેપેસીટર વિશે સમજાવો (7)	(7)
Q-4	Attempt all questions	(14)
(A)	જુદા જુદા પ્રકાર ની સ્વીચ ની તેના સીમ્બોલ સાથે યાદી બનાવો (7)	(7)
(B)	ઇલેક્ટ્રો મેઝેટીક રીલે નો કાર્ય સિદ્ધાંત સમજાવો (7)	(7)
Q-5	Attempt all questions	(14)
(A)	સર્કિટ ડાયાગ્રામ અને વેવફોર્મ સાથે છાફ વેવ રેક્ટીફિયર વિશે સમજાવો (7)	(7)
(B)	$\pi$ પ્રકાર ના ફીલ્ટર વિશે વર્ણવો (7)	(7)
Q-6	Attempt all questions	(14)
(A)	કરેટ ગેઇન પેરામીટર $\alpha$ અને $\beta$ વચ્ચે નો સમ્બંધ તારવો (7)	(7)
(B)	ટ્રાંઝીસ્ટર નું બંધારન સમજાવો (7)	(7)
Q-7	Attempt all questions	(14)
(A)	જુદા જુદા પ્રકાર ના કેબલ વિશે વર્ણવો (7)	(7)
(B)	જુદા જુદા પ્રકાર ના ફ્યુજ નું લીસ્ટ બનાવો કોઈ એક ને વિસ્તાર થી સમજાવો (7)	(7)
Q-8	Attempt all questions	(14)
(A)	વેરેક્ટર ડાયોડ વિશે સમજાવો (7)	(7)
(B)	અવરોધના કલર કોડ ની રીત સમજાવો (7)	(7)

